

---

BBC LEARNING ENGLISH

## English Together

Is one career enough?



*This is not a word-for-word transcript*

---

પ્રેઝન્ટર

હેલો એન્ડ વેલકમ, English Togetherમાં આપનું સ્વાગત છે. હું છું રિષી.....અને આજે મારી સાથે છે.

**Sam**

Hello, I'm Sam.

**Tom**

And I'm Tom. Welcome to today's programme!

પ્રેઝન્ટર

મિત્રો, દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે સારી કારકિર્દી બનાવવાની. આજે જ્યારે વિશ્વ બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યારે પ્રશ્ન થાય છે એક વ્યક્તિ જીવનમાં કેટલી વખત 'careers' એટલે કે કારકિર્દી બનાવી શકે છે?

એક સામાન્ય માનવી કેટલી વખત પોતાની કારકિર્દી બદલી શકે છે? તમને શું લાગે છે મિત્રો? આનો જવાબ શું હોઈ શકે?

અ) 2-5

બ) 5-7

ક) 7-10

અમે તમને આ સવાલનો જવાબ થોડીવારમાં આપીશું.

**Sam**

Mmh, I don't know! What do you think, Tom?

**Tom**

Mmh, I'm not the right person to ask, really. I don't like change.

પ્રેઝન્ટર

વેલ લાગે છે ટોમને પોતાની કારકિર્દીથી ઘણો સંતોષ છે અને એટલે જ એ હવે કોઈ પણ પ્રકારનો ફેરફાર ઇચ્છતો નથી. મિત્રો, હવે તમે BBC Radio 4 દ્વારા બનાવવામાં આવેલા ન્યૂઝ રિપોર્ટ સાંભળો જેમાં આપણી 'working lives' એટલે કે 'ક્રિયાશીલ જીવન' કેવી રીતે બદલાઈ રહી છે, એના ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

### **News report**

What do you want to be when you grow up? It's a question that we all get asked as little kids. When we're five years old, it's a fun game, but as we get older we start to believe that we need to narrow our focus and devote our lives to one thing. But that is becoming less and less true. In such a rapidly changing economy, it makes sense to assume that more and more of us will be changing careers or holding down several careers at the same time. So is one career enough anymore?

### **Tom**

Wait a minute. "Holding down several careers at the same time"? What exactly are they saying?

પ્રેઝન્ટર

વેલ, 'holding down a career or a job' નો અર્થ થાય છે નોકરી અથવા કારકિર્દીને પકડી રાખવું. It means that you would have more than one job at the same time.

### **Tom**

So, I'd hold down this job, and then one or two others, as well? When would I sleep?

### **Sam**

I don't think it means you'll be working full time on all these jobs, Tom!

પ્રેઝન્ટર

Yeah, you would probably have two or three part time jobs.

### **Sam**

The report also says we might have *one* job at a time, but switch careers after a few years.

પ્રેઝન્ટર

'Switch' એ 'change' નો સમાનાર્થી શબ્દ છે.

### **Sam**

Exactly, so you could switch from this job, to being a lawyer, for example. Actually, you'd make a great lawyer, Tom! You could argue for a living!

**Tom**

Maybe...maybe, I should. So, what's wrong with having a job for life? My uncle was a farmer all his life, and my mother was a nurse for all her life. They devoted themselves to one thing and they did it very well.

**પ્રેઝન્ટર**

'To devote ourselves' એટલે પોતાની જાતને સમર્પિત કરવી. And I've devoted myself to making you laugh, Tom. One day!

**Sam**

Maybe you can still devote yourself to one area of work, like medicine, for instance, but have more than one career in that area.

**પ્રેઝન્ટર**

એકદમ બરાબર. મિત્રો, હવે તમને આગળ જે પ્રશ્ન પૂછ્યો હતો કે એક સામાન્ય માનવી કેટલી વખત પોતાની કારકિર્દી બદલી શકે છે? અને જવાબ છે ઓપ્શન બ) એટલે કે 5-7 વખત. Still not convinced, Tom?

**Tom**

I just don't understand how switching jobs 5-7 times is good – good for you or good for your employer. They'll train you in something, and then you become good at it, and then you leave!

**Sam**

But you can still take what you've learned in one job and bring it to the next one. For people like me, who are into lots of different things, this is great news!

**પ્રેઝન્ટર**

'To be into' નો અર્થ થાય છે અંદર. But, Sam, you're into too many things! How would you choose your next career?

**Tom**

Yeah, Sam, you change your mind all the time. Last week you were into working with animals, this week you're into working in a restaurant. What's it going to be next week?

**Sam**

Actually, I've been reading lots about...

**Tom**

Yeah, what is it? Here we go!

પ્રેઝન્ટર

અને ફરીથી સેમે એજ વાત કરી! પણ તમારું આ અંગે શું માનવું છે મિત્રો? શું તમે એકથી વધારે નોકરીઓને 'hold down' કરશો? કે પછી તમારી જાતને એક જ કારકિર્દી ઉપર 'to devote yourself to' જેવું કરશો?

આજે આપણે કારકિર્દી સાથે સલંગન જે પણ શીખ્યાં એનું પુનરાવર્તન કરી લઈએ. 'To hold down a job', એટલે નોકરી અથવા કારકિર્દીને પકડી રાખવી, 'to switch careers' નો અર્થ થાય છે કારકિર્દી બદલતા રહેવી.

'To devote ourselves to something' એટલે પોતાની જાતને કોઈ કાર્યમાં સમર્પિત કરવું અને 'to be into something' નો અર્થ થાય છે કોઈ કાર્ય અથવા કામની અંદર પ્રવૃત્ત રહેવું.

આવા જ બીજા રસપ્રદ ટોપિક્સ સાથે ફરીથી મળીશું English Togetherમાં. ત્યાં સુધી..Bye!